

August 16, 2022

To,

**Department of Corporate Services
BSE Limited**

Ground Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001

Security ID: ASHNI

Security Code: 541702

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on 30th June, 2022.

Dear Sir/Madam,


Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on June 30, 2022 as per Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Ashnisha Industries Limited



**Shalin A. Shah
Director
DIN: 00297447**



Encl: As above

10,000 cusecs being released from Sardar Sarovar dam

GANDHINAGAR / AHMEDABAD: Sardar Sarovar Narmada Nigam Limited (SSNNL) on Friday began releasing water from the Sardar Sarovar dam. For the first time this monsoon, water was released being at a rate of 10,000 cusecs on Friday from five gates of the dam.



As of Friday, the dam was filled to 83% of its capacity and the water level stood at 133.95 metres. The level has been increasing by three to four centimetres every hour.

The Sabarmati in Ahmedabad got about 4,000 cusecs of Narmada water on Friday. According to AMC

officials, the fresh Narmada water flushed out the stagnant water from the river. "Only 1,000 cusecs was released from the Vasna Barrage," said an AMC official. With the water level increasing steadily in the dam, for the past 20 days, the riverbed power house has been generating about two million units of electricity worth Rs 4 crore daily, according to an

official statement. The canal head power station began producing electricity on Friday. According to the officials, about 20,000 cusecs of water will be released for irrigation purposes into the Narmada main canal. With 10,000 cusecs of water being released into downstream areas, the district administrations of Narmada and Bharuch districts have been asked to remain alert. The government officials said that the other 206 dams, barring Narmada dam, have total storage of 65.14% which was 2,695.6 million cubic metres more than the storage last year.

DISHA RESOURCES LIMITED				
REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H. AJANTA COMM. ESTATE OFF ASHRAM ROAD, INCOME TAX, AHMEDABAD-380014				
PHONE: (OFF). 2754-0790, 27543060 E-MAIL: info@aacl.co.in CIN: L74110GJ1995PLC024869				
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30 th JUNE, 2022. (In Lakhs)				
PARTICULARS	Quarter ended on 30/06/2022 (Unaudited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 30/06/2021 (Unaudited)	Year ended on 31/03/2022 (Audited)
Total Income from Operations	-	-	114.16	148.03
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Net profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Net profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Total Comprehensive Income for the period (Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)	(100.22)	375.97	311.96	1680.97
Paid-up equity Share Capital	731.55	731.55	731.55	731.55
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2041.17	2141.39	772.37	2141.39
Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
-Basic	(1.37)	5.14	4.26	22.98
-Diluted	(1.37)	5.14	4.26	22.98

Notes:
 1. The above is an extract of the detailed format of quarter and three months ended unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Audited Financial Results is available on the stock Exchange website - www.bseindia.com & on company's website - www.aacl.co.in
 2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 13th August, 2022.
 3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 30th June, 2022 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

FORDISHA RESOURCES LIMITED
 KRISHNA AWATAR KABRA
 MANAGING DIRECTOR
 DIN: 00650817

Date: 13/08/2022
 Place: Ahmedabad



13 થી 15 ઓગસ્ટ
દર ઘર
તિરંગા
લહેરાવીએ
 આઝાદીનો અમૃત મહેલસવ મનાવીએ



Let us hoist the Tricolor at our house from 13th to 15th August and showcase our solidarity.

Narendra Modi,
 Prime Minister



ASHNISHA INDUSTRIES LIMITED				
Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospita, Mithakhali Six Roads, Ahmedabad 380 006. CIN :L74110GJ2009PLC057629				
STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022.				
Particulars	Quarter ending	Previous Year ended	Corresponding 3 months ended in the previous year	
	30/06/2022	31/03/2022	30/06/2021	30/06/2021
	Unaudited	Audited	Unaudited	Unaudited
Total income from operations	273.83	1127.99	149.05	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1.43	122.87	-24.98	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1.43	122.87	-24.98	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1.43	42.18	-24.98	
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	1.43	42.18	-24.98	
Equity Share Capital	301.88	301.88	301.88	
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)				
Basic :	0.005	1.40	-0.83	
Diluted:	0.005	1.40	-0.83	
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)				
Basic :	0.005	1.40	-0.83	
Diluted :	0.005	1.40	-0.83	

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022. (Rs. In Lacs)				
Particulars	Quarter ending	Previous Year ended	Corresponding 3 months ended in the previous year	
	30/06/2022	31/03/2022	30/06/2021	30/06/2021
	Unaudited	Audited	Unaudited	Unaudited
Total income from operations	75.14	50.30	0.00	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	25.24	-13.54	-3.88	
Profit after tax	25.24	-13.54	-3.88	

Notes:
 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashnisha.in)

For, ASHNISHA INDUSTRIES LIMITED
 SD/-
 ASHOK C. SHAH
 DIRECTOR
 DIN: 02467830

Date : 13/08/2022
 Place : Ahmedabad

Let us salute the Tricolor

Let us adorn Gujarat with 1 crore tricolors



Mera Ghar Mera Tiranga
www.harghartiranga.com

સ્વાઈન ફ્લૂનાં એક મહિનામાં ત્રીસ કેસ, અમદાવાદમાં કોરોના ઉપરાંત સ્વાઈન ફ્લૂનાં નવા સંકટ સામે મ્યુનિ.તંત્ર સતર્ક

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણની સાથે હવે શહેરીજનો ઉપર નવું સંકટ જોવા મળી રહ્યું છે. એક જ મહિનાના સમયમાં સ્વાઈન ફ્લૂનાં ત્રીસ કેસ નોંધાતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. પચાસ ટકા દર્દી શારદાબેન હોસ્પિટલ ઉપરાંત એલ.જી.હોસ્પિટલ, વી.એસ.તેમજ એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાકીના દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. નોંધપાત્ર બાબત એ છે કે, સ્વાઈન ફ્લૂનાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં એક ચાર વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે મોસમનો અત્યાર સુધીમાં શહેરમાં ૨૭ ઈંગ્લિશ વધુ વરસાદ વરસી ગયો છે. આ પરિસ્થિતિમાં શહેરના અનેક વિસ્તારમાં ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડેપુટી કમિશનર સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, જુલાઈ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને સ્વાઈન ફ્લૂના ત્રીસ દર્દી નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન ઉપરાંત એલ.જી. હોસ્પિટલ તેમજ વી.એસ.હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલ ખાતે અલાયદો વોર્ડ રાખવામાં આવ્યો છે. દર્દીઓમાં ચાર વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક જી.સી.એસ.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતના ૭૧ લાખ પરિવારોને મળી રાહત, ૨૦૦ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયામાં મળશે સિંગલેલ

દેવે માત્ર ૧૦૦ રૂપિયામાં આપશે. સરકારે આ જાહેરાત કરીને ગરીબોને રાહત આપી છે. આ અંગે જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હવે તહેવારોની મોસમ આવી રહી છે. આવકમાં ઘટાડો થયેલા ગરીબોને સરકાર ૧૦૦ રૂપિયા લિટરના ભાવે સિંગલેલ આપવામાં આવશે. સરકારે નિર્ણય કર્યો કે, તમામ ૭૧ લાખ કાર્ડ ધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે ૧ લિટર સિંગલેલ સસ્તા દરે આપે છે ત્યારે આગામી તહેવારો દરમિયાન મોઠા ભાવનું એટલે કે જે સિંગલેલ ની બજાર કિંમત ૨૦૦ રૂપિયા આસપાસ છે તે સિંગલેલ કાર્ડ ધારકોને માત્ર ૧૦૦ રૂપિયાની કિંમતે આપશે.



ગાંધીનગર : પાઘ તેલના વધી રહેલા તોલિંગ ભાવોએ હવે લોકોની કમર તોડી નાંખી છે. પાઘ તેલોમાં એટલો ભાવ વધી રહ્યો છે કે, હવે એક દિવસ તે લક્ષ્મીરિયસ ખાણીપીણીમાં ન આવે જાય. ત્યારે ગુજરાત સરકારે ૨૦૦ રૂપિયાનું એક લિટર સિંગલેલ

MANAPPURAM HOME FINANCE LTD.
મહાપુરમ હોમ ફાઇનાન્સ લીમિટેડ
મહાપુરમ હોમ ફાઇનાન્સ પ્રા.લી. તરીકે ઓળખાય
CIN : U65923K12010PIC039179

મહાપુરમ હોમ ફાઇનાન્સ લી. એટ યુનિટ ૩૦૧- ૩૧૫, ૩જા માળ, એ વિન્ચ કનકીયા વોલ સ્ટ્રીટ, અંધેરી- કુર્લા રોડ, અંધેરી ઈસ્ટ, સુબર્બ- ૪૦૦૦૮૩, સંપર્ક નં. ૦૨૨-૨૬૧૮૪૪૦૦૦/૦૨૨-૨૬૨૧૧૦૦૦

સુધારો
સરકેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ હરાજી વેચાણ નોટિસ
નીચેની એન્ટ્રસ ના વેચાણ માટે

મહાપુરમ હોમ ફાઇનાન્સ લી. એ હરાજી વેચાણની નોટિસ મિલકત માટે સીક્યુરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીફાઇન્ડિંગ એન્ડ ફાઇનાન્સિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ વાંધી આ ન્યૂઝ પેપર માં ૧૮મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ નોટિસ પ્રસિદ્ધ કરી હતી. તેમા ઈન્વેસ્ટમેન્ટના જમા માટે અંતિમ તારીખ, ટેન્ડર ફોર્મ સબમીશન અને હરાજીની તારીખ અને સમય વધારીને ૨૯/૦૮/૨૦૨૨ ના રોજ ૩.૦૦ વાગે નીચેની મિલકતના વેચાણ માટે મહાપુરમ હોમ ફાઇનાન્સ લી., બિલ્ડિંગ શોપ નં. ૧૨, ૧૩, ૧૪ માળ, ઈન્દ્રપ્રસ્થ હોલ, માવડી મેટ્રો રોડ, માવડી સર્કલ, એશબીઆઈ, રાજકોટે તા., પીન- ૩૬૦ ૦૦૮.

ક્ર. નં.	કારણદાર/સહ-કારણદાર/જામીનદારનું નામ અને લોન એકાઉન્ટ નંબર/જાણ્ય	સિદ્ધાંત મિલકતની વિગત	વિભાગિક રિવેન્યુ પ્રાઇઝ (રૂ.) અને ઈન્કમી	છેલ્લી હરાજીની વિગત
૧.	દેવેન મનહરલાલ દાનીધારીયા, ભાનાબેન દેવેન ભાઈ દાનીધારીયા, ભાનાબેન દેવેનભાઈ દાનીધારીયા/ WRAJK0002321/ રાજકોટે.	ફલેટ નં. ૧૦૩, પ્રથમ માળ, ગ્રીન પાર્ક, મારટેલ ધ વિલેજ હોટેલ, કાલાવાડ રોડ, વાજીરી વિસ્તાર, જિલ્લો રાજકોટે- ૩૬૦૦૦૫.	રૂ. ૭,૦૦,૦૦૦/- અને રૂ. ૧,૭૫,૦૦૦/-	૨૦-૧૧-૨૦૧૮ થી ૩.૦૦ કલાક સુધી.

અન્ય નિયમો અને શર્તો ટેન્ડર ફોર્મ અને વેચાણ નોટિસના અપરિવર્તિત છે.
તારીખ : ૧૪/૦૮/૨૦૨૨
સ્થળ : ગુજરાત

મહેતા હાઉસિંગ ફાઇનાન્સ લી.
૨૪૨૨૨ ઓફિસ : પ્લોટ નં. ૧ એ, રેવેન્યુ સર્વે નં. ૨૦૩, પી.૧, સાસરુકલા રોડ, તલેલ મહુભા, ભાવનગર, ગુજરાત-૩૬૪૨૬૦
ઈમેલ : mehtahousingfinance@gmail.com
સી.નં. L65910GJ1993PLC020699

૩૦મી જૂન, ૨૦૨૨ ના ત્રેમાસિક અંતેના અન-ઓડિટેડ નાણાકીય પરિણામનો ઉતારો

ક્ર. નં.	વિગતો	ત્રેમાસિક અંતે			
		૩૦.૦૬.૨૦૨૨ અન-ઓડિટેડ	૩૧.૦૩.૨૦૨૨ ઓડિટેડ	૩૦.૦૬.૨૦૨૧ અન-ઓડિટેડ	૩૧.૦૩.૨૦૨૧ ઓડિટેડ
1.	કામચલાઉની કુલ આવક ચોખ્ખો નફો / (નુકસાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આવકમાં #)	0.00	0.00	0.00	0.00
3.	ચોખ્ખો નફો / (નુકસાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આવકમાં #)	(6.82)	(3.28)	(0.20)	(9.41)
4.	ચોખ્ખો નફો / (નુકસાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આવકમાં #)	(6.82)	(3.28)	(0.20)	(9.41)
5.	નફો / (નુકસાન) ટેક્સ પછી અને પ્રીજી સર્વિસ/કેસિયલ આવક અથવા અસાધારણ આવક (ટેક્સ પછી)	(6.82)	(3.28)	(0.20)	(9.41)
6.	ઈક્વિટી શેર મુદ્દી	308.20	308.20	308.20	308.20
7.	નવ વર્ષ અંતે ઓડિટેડ બેલેન્સશીટમાં કરેલી જોગવાઈ પ્રમાણે અનામત (અનામતનું મુલ્યાંકન પ્રમાણે)				217.38
8.	શેરદાહ કમાણી (અસાધારણ આવકમાં પૂરું) (રૂ. ૧૦/- પ્રત્યેક) (જાહેર નથી કરેલ) : રૂ. માં (૨) બેઝિક (૨) ડિલ્ટેડ	1. (0.221)	1. (0.106)	1. (0.006)	1. (0.305)
		2. (0.221)	2. (0.106)	2. (0.006)	2. (0.305)

નોંધ : આથી ઉપરના ઉતારાની વિગત કાર્પોરેટ ના અન-ઓડિટેડ નાણાકીય પરિણામો તે સહિત એક્સચેન્જમાં સેબીની કલમ ૩૩ (સિસ્ટીમ એન્ડ અપર ડિસ્ક્લોઝર રિજલેશન-૨૦૧૫) રેગ્યુલેશન-૨૦૧૫, આ પરિણામ અને ઓડિટેડનો મહાદિન અહેવાલ સાથે બીએસઈ લીમિટેડ (બીએસઈ)ની વેબસાઇટ (URL www.bseindia.com) અને ઈપીની વેબસાઇટ (URL www.mehtahousing.com) ઉપર પણ ઉપલબ્ધ છે. આ અન-ઓડિટેડ નાણાકીય પરિણામો ઓડિટેડ કમ્પાઈ માર્કને તપાસવામાં આવ્યા છે અને તા. ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ મળેલી બોર્ડ ઓફ ડાયરેક્ટરોની બેઠકમાં તપાસવામાં આવ્યા હતા.

મહેતા હાઉસિંગ ફાઇનાન્સ લીમિટેડ વતી સહી/ વિશ્વાસ રૂપરેક્ટર
ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર
પીન-૦૦૦૭૭૭૬૭

સ્થળ : મહુભા
તારીખ : ૧૩ ઓગસ્ટ, ૨૦૨૨

UTL Industries Limited
Registered Office: 1st Floor, Vadodara Hyper, Vikram Sarabhai Marg Opp. Sarabhai Chemicals, Nr. Genda Circle Vadodara, Gujarat, India-390007 Script code: 500426
Tel: +91 74339 73999, Email: utlindustries@gmail.com
Website: www.utlindustries.com, CIN: L27100GJ1989PLC012843

(Rs. in lakhs, except per share data)

S. No.	PARTICULARS	QUARTER ENDED				YEAR ENDED
		Unaudited		Audited		
		30-Jun-22	31-Mar-22	30-Jun-21	31-Mar-22	
1	Total Income from Operations					
	a) Revenue from Operations	1.38	2.71	1.70	7.67	
	b) Other Income	0.22	1.73	4.43	7.29	
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(1.70)	(6.49)	0.37	(20.26)	
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(1.70)	(7.18)	0.37	(20.95)	
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	(1.75)	(6.32)	0.30	(20.88)	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	(1.75)	(6.32)	0.30	(20.88)	
6	Equity Share Capital (face value of Rs. 1/- per share)	329.55	329.55	329.55	329.55	
7	Other Equity (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the previous year					
8	Earning Per Share (EPS) (face value of Rs. 1/- per share) (EPS for the quarters/periods is not annualised)	(0.01)	(0.02)	0.00	(0.06)	
	(a) Basic					
	(b) Diluted					

Notes :
1. The above is an extract of the detailed format of Unaudited Financial results pursuant to Regulation 35 of Securities Contracts (Regulation) (Stock Exchange & Clearing Corporations) Regulation, 2018, as amended from time to time, read with Regulation 33 of the SEBI (Listing & Other Disclosure Requirements) Regulations, 2015.
2. The above is an extract of quarter ended results which have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 13th of August 2022.
3. The financial figures of the last quarter ended 31st March, 2022 are the balancing figures between the audited figures in respect of the full financial year ended on 31st March, 2022 and the unaudited published year to date figures for the three months upto 30th June 2022.
4. Company operates in two segments viz. Construction and SMS Services. Separate information in terms of Ind AS 108 "Operating Segment" is reported as the total revenue is 10% or more of combined revenue of all operating segments.
5. The above results have been prepared in accordance with the Indian Accounting Standard ("Ind-AS") as notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended). Specified under section 133 of the Companies Act, 2013.
6. Previous period figures have been re-grouped/re-arranged wherever to make them comparable with current period figure.
7. The above is an extract of detailed format of the unaudited Financial Results for the quarter ended on 30th June, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the Financial Results are available on the websites of the BSE (www.bseindia.com) and on the company's website at (www.utlindustries.com).

For and on the behalf of the Board For UTL Industries Ltd.
Sd/-
Pravin Nagarji Naik
Managing Director
Din : 09388334

Date : 13/08/2022
Place : VADODARA

છ લોકોનો ભોગ લેનાર કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો

આણંદ, આણંદ જિલ્લામાં કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી. કાર, રિક્ષા અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ૬ લોકોને કાળ ભરખી ગયો હતો, જેમાં એક પરિવારના ત્રણ સભ્ય, જે ભાઈનો રાખડી બાંધીને આવતા હતા. બીજા પરિવારની બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં જે કારચાલકે અકસ્માત સર્જ્યો એ કારચાલક સોજીત્રાના કોંગ્રી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે, જેઓ દારૂના ચિકાર નશામાં હોવાનો મુતકનાં પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. મળતી માહિતી મુજબ, સોજીત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનાં પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીબા ગામે ગયા હતા. તેઓ ત્યાંથી મોત સોજીત્રા આવવા માટે યાસીન મહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. તેઓ તારાપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા હતા એ સમયે ટીબા ગામ પાસે અચાનક કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે રિક્ષાચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચારનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં.

આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે રિક્ષાચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચારનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં.

ગોધરા-વડોદરા હાઈવે પર એસટી બસના ડ્રાઈવરે બસ સાઈડમાં દબાવતા લોકો ઈજાસ્ત થયા

પંચમહાલ, ગોધરા શહેરના હાલોલ વડોદરા હાઈવે ઉપર આવેલ કોટી ત્રણ રસ્તા પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે કોટી મોર્ટર પાસે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગ કરતો પત્ર માર્ગ અને મકાન વિભાગને એડવોકેટ રમજાની જુજારા કરી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં ન આવતા ફરી એકવાર બસ ચાલકે એક જ પરિવારના છ જેટલા સભ્યોને અડકેટમાં લીધા હતા. જેમાં પાંચનો આબાદ બચાવ થયો, જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગોધરાના વડોદરા હાઈવે પાસે આવેલ કોટી ત્રણ રસ્તા ઉપર એક બસ ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવતા છ લોકોને અડકેટમાં લીધા હતા. જેમાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ

સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ગોધરાના સીમલિયા પાલી ગામે આવેલ વૃંદાવન ફળિયામાં રહેતા મહાસુખભાઈ ભાવસિંગભાઈ નાયક પોતાના પરિવારના સભ્યોને લઈને પોતાની દીકરી અને જમાઈના ઘરે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે ગોધરા પાસે આવેલ સારંગપુર ખાતે નીકળ્યા હતા. ત્યારે તેઓ ગોધરાના વડોદરા હાઈવે ઉપર આવેલ કોટી ત્રણ રસ્તા ઉપર બસની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે બાયડી પાવાગઢ તરફ જઈ રહેલી એસ.ટી બસના ચાલકે પોતાની બસ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં ઊભા રહેલા મહાસુખભાઈ નાયક સહિત છ લોકોને અડકેટમાં લીધા હતા. જેમાં એક નાના બાળક સહિત પાંચ લોકોનો ડુદરતી રીતે બચાવ થયો હતો. જ્યારે મહાસુખભાઈ નાયકને માથાના ભાગે અને પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ઈએફસી (આઈ) લિમિટેડ
(અનાઈ અમાની ટ્રેડિંગ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ તરીકે જાણીતી)

૨૪, ઓફિસ : ૩૨, વિનાયક સોલવેટી, જવાહર સો સામે, મિલિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮.
કોર્પોરેટ ઓફિસ : પ્લોટ નં. ૧, ૨, ૩, ૪ અને ૬, અમલ, લોકો કોલેજ, અંબા, ૨૦૮(બી), સીડીબેન પુર્વ ૬૧૧૦૦૭
CIN : L7110GJ1063198APL020006 ટેલ : ૦૨૦ ૩૨૨ ૯૯૨૨
Email : amanexport@yahoo.co.in, Website : www.amanitrading.in
૩૦ જૂન, ૨૦૨૨ ના રોજ પુરા થતાં ત્રેમાસિક સમયગાળાનું નાણાકીય પરિણામ દર્શાવતું ઓડિટેડ ક્યાં વગરનું નિવેદન

ક્ર. નં.	વિગતો	ત્રેમાસિક અને ૩૦-૬-૨૦૨૨	ત્રેમાસિક અને ૩૦-૬-૨૦૨૧
1	કામચલાઉની કુલ આવક	40,00,000.00	4,10,000.00
2	નફો/(નુકસાન) ટેક્સ પહેલાં, સામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા	34,83,029.00	2,20,000.00
3	નફો/(નુકસાન) ટેક્સ પાદ, સામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા	25,77,442.00	1,90,000.00
4	નફો/(નુકસાન) ટેક્સ પહેલાં, અપવાદી અને અસાધારણ પ્રવૃત્તિઓ પાદ	34,83,029.00	2,20,000.00
5	નફો/(નુકસાન) ટેક્સ પછી, અપવાદી અને અસાધારણ પ્રવૃત્તિઓ પાદ	25,77,442.00	1,90,000.00
6	ઈક્વિટી શેર મુદ્દી (વેર ટેક કેસ વેલ્યુ રૂ. ૧૦/-)	69,97,000.00	69,97,000.00
7	અનામતો	1,20,57,092.79	95,46,000.00
8	શેર દેહ કમાણી (અસાધારણ પ્રવૃત્તિઓ પહેલાં) (રૂ. ૧૦/- શેર દેહ) (ઈપીએસ ત્રિમાસિક સમયનો)	3.68	0.28
	(એ) મૂળ - રૂ. માં		
	(બી) મેક - રૂ. માં		
9	શેર દેહ કમાણી (અસાધારણ પ્રવૃત્તિઓ પાદ) (રૂ. ૧૦/- શેર દેહ) (ઈપીએસ ત્રિમાસિક સમયનો)	3.68	0.28
	(એ) મૂળ - રૂ. માં		
	(બી) મેક - રૂ. માં		

નોંધ :
૧. વધુ વર્ષ કે ગણ સમયગાળાના અંદાજ કરી શકી જરૂર જણાય ત્યારે ત્રિમાસિક અંદાજ કે રિપુર્ટ કરવામાં આવ્યા છે.
૨. ઉપરોક્ત નાણાકીય નિવેદન ઓડિટેડ કમ્પાઈ દ્વારા તપાસવામાં આવેલ છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નેમનો ના. ૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ બોલવા એકમમાં નીચીલ કરવામાં આવેલ છે. ૩૦મી જૂન, ૨૦૨૨ ના પુરા થતા ત્રેમાસિક સમયગાળાના નિવેદન ઓડિટેડ દ્વારા વિનિત કરવામાં આવેલ છે.
૩. ઈપીએસ માટે જ એમ્બેડ-પ્લો ક્રમ કરી રહી છે. આથી અર્ધ-અમાની એમ્બેડ-૧૦૮ આપોલોઈ સેગમેન્ટ કંપનીને લાયક પડતો નથી.

ઈએફસી (આઈ) લિમિટેડ વતી,
(અનાઈ અમાની ટ્રેડિંગ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ તરીકે જાણીતી)
સ્થળ : અમદાવાદ
તારીખ : ૧૪-૮-૨૦૨૨

ઈએફસી (આઈ) લિમિટેડ વતી,
(અનાઈ અમાની ટ્રેડિંગ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ તરીકે જાણીતી)
સ્થળ : અમદાવાદ
તારીખ : ૧૪-૮-૨૦૨૨

DISHA RESOURCES LIMITED
REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H. AJANTA COMM. ESTATE OFF ASHRAM ROAD, INCOME TAX, AHMEDABAD-380014
PHONE: (OFF) 2754-0790, 27543060 E-MAIL: info@aal.co.in CIN: L74110GJ1995PLC024869

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30th JUNE, 2022. (In Lakhs)

PARTICULARS	Quarter ended on 30/06/2022 (Unaudited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 30/06/2021 (Unaudited)	Year ended on 31/03/2022 (Audited)
Total Income from Operations	-	-	114.16	148.03
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(8.36)	24.46	(1.57)	20.28
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	(100.22)	375.97	311.96	1680.97
Paaid-up equity Share Capital	731.55	731.55	731.55	731.55
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2041.17	2141.39	772.37	2141.39
Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(1.37)	5.14	4.26	22.98
-Basic	(1.37)	5.14	4.26	22.98
-Diluted	(1.37)	5.14	4.26	22.98

Notes :
1. The above is an extract of the detailed format of quarter and three months ended unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Audited Financial Results is available on the stock exchange website - www.bseindia.com & on company's website - www.aal.co.in
2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 13th August, 2022.
3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 30th June, 2022 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

FORDISHA RESOURCES LIMITED
KRISHNA AWATAR KABRA
MANAGING DIRECTOR
DIN: 00650817

Date: 13/08/2022
Place: Ahmedabad

ASHNISHA INDUSTRIES LIMITED
Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospita , Mithakhali Six Roads , Ahmedabad 380 006. CIN : L74110GJ2009PLC057629

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022.

Particulars	Quarter ending	Previous Year ended	Corresponding 3 months ended in the previous year</
-------------	----------------	---------------------	---